

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૪/૦૭/૨૦૧૭ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૫૦૪/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૦ કેસ કરી ૨૭ વ્યક્તિઓને ઝડપી, ૧૨૬ લીટર દેશી દારૂ, ૧૦૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૪૮ બિયર ટીન, ૧ સ્ફૂટર અને ૧ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૨૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૧૪,૩૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૦૫/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઠગાઈ:-

સમાચાર યાદી નં.૧૫૦૬/૧૭

માધવપુરા: પ્રતીક સુનીલભાઈ શાહ (ઉ.વ.૨૮) (રહે. શાશ્વત ફ્લેટ અનમોલ બંગલોઝ સામે ન્યુ રાણીપ) નરોડા મેમ્કો શાયોના એસ્ટેટસી-૩ વુલ્કન એક્સપ્રેસ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે જે કંપનીમાં તેઓ ઓનલાઈન શોપીંગથી ગ્રાહકોના ઓર્ડર મુજબ મોબાઈલ ફોન ગ્રાહકોના સરનામા ઉપર પહોંચાડવાનું કામ કરે છે જે કામના ભાગરૂપે કંપનીમાં કામ કરતો રાહુલ પ્રજાપતિ જુદીજુદી કંપનીના મોબાઈલ ફોન નં.૧૮૮ નું પાર્સલ કિંમત રૂપિયા ૧,૫૩,૦૬૩/- તા.૨૮/૩/૧૭ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે શાહીબાગ શિલાલેખ ટાવરના પાછળના ભાગેથી આરોપી જયપાલસિંહ બારોટ રહે.બારોટ હાઉસ એન્ડ સનસાઈન કન્ટ્રક્શન કંપની હેવમોર પાર્લરની બાજુમાં રીવરફ્રન્ટપાર્ક સામે શાહીબાગ) ને આપવા ગયા હતા ત્યારે જયપાલસિંહ અને અન્ય એક પુરૂષ રાહુલને વિશ્વાસમાં લઈ મોબાઈલ ફોનના પૈસા આપુ તેમ કહી મેઘાણીનગર મેન્ટલ બારી સુધી લઈ જઈ નજર ચુકવી છેતરપીંડી કરી મોબાઈલનું પાર્સલ લઈ પલાયન થઈ ગયા હતા આ અંગેની ફરીયાદ પ્રતીક શાહે તા.૨૩/૭/૧૭ નારોજ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.એમ.ઝાલા ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૫૦૭/૧૭

સરખેજ: મયુરભાઈ સુર્યકાન્ત પરમાર (રહે. શિવનગર રો હાઉસ સહવાસ એપાર્ટમેન્ટની બાજુમા જીવરાજપાર્ક વેજલપુર) એ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૨૨/૭/૧૭ રાતના ૮/૦૦ થી તા.૨૩/૭/૧૭ સવારના ૧૦/૩૦ વાગ્યા દરમ્યાન મેલડી કોમ્પ્લેક્ષમા આવેલ રક્ષા પાઈપ્સની ઓફીસના શટર તોડી ટેબલના ડ્રોવરમાથી રોકડ રૂપિયા ૪૫,૦૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.બી.ચૌધરી ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૫૦૮/૧૭

સેટેલાઈટ: નકુલભાઈ નજુભાઈ મીશ્રા (ઉ.વ.૫૪) (રહે. અશોકનગર સોસાયટી ગેટ નંબર-૨ જોધપુર સેટેલાઈટ) તા.૨૩/૭/૧૭ કલાક ૮/૧૫ સેટેલાઈટ પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલ એક્ષીસ બેંકની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ (૨૫ થી ૩૦ વર્ષના આશરાના) બે પુરૂષ નકુલભાઈ મીશ્રાના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૨૭,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ નકુલભાઈ મીશ્રાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.બી.ઝાલા ચલાવે છે.

મકાનની છત તુટી પડતા મૃત્યુ:

સમાચાર યાદી નં.૧૫૦૯/૧૭

ખાડીયા: ખાડીયા ફતાશા પોળ ગાંધી રોડ ખાતે રહેતા રાજુભાઈ કાળાભાઈ ઠાકોર તા.૨૪/૦૭/૧૭ નારોજ તેમના પરીવાર સાથે પોતાના ઘરે રાત્રે સુતા હતા ત્યારે કલાક ૩/૩૦ વાગ્યાના સુમારે વરસાદના કારણે મકાનની છત તુટી પડતા દટાઈ જતા રાજુભાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે વા.સા.હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હસ્ટા અંગે ખાડીયા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એચ.વ્યાસ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.